

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા “ગીર સાવજ”

ચણા અને ઘઉં (ફાઉન્ડેશન / સર્ટીફાઇડ/ ટ્રુથફૂલ) બિયારણના વેચાણ બાબત

આથી ખેડૂતોને જણાવવાનું કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી રબી-૨૦૨૧-૨૨ ઋતુમાં વાવેતર માટે ચણાની જીજી-૩ અને જીજી-૫ તથા ઘઉંની LOK-1, GW-451 અને GW-496 જાતોનું ફાઉન્ડેશન/સર્ટીફાઇડ/ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર) બીયારણ ખરીદી માટે ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવેલ. તે અરજીઓના કોમ્પ્યુટરાઇઝ્ડ રેન્ડમાઇઝેશન સીસ્ટમથી રેન્ડમાઇઝેશન બાદ પસંદગી પામેલ ખેડૂતોને, જ્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઉત્પાદિત ઘઉંની GJW-463 અને GW-366 જાતોનું વેચાણ વહેલા તે પહેલાંના ધોરણે કરવાનું આ સાથે નીચે જણાવેલ શરતોના યુસ્તપણે પાલન કરવાની શરતે થાય છે. બિયારણના ભાવની વિગતો નીચે કોષ્ટકમાં જણાવેલ છે. વધુ માહિતી માટે સીડ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન નં.૦૨૮૫-૨૬૭૫૦૭૦ તથા ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૮૦પીબીએક્ષ ૪૪૯-૪૫૦ થી સંપર્ક કરવો.

પાક અને જાતનું નામ	બિયારણની કક્ષા	સબસીડી સહાય વિનાનો ભાવ	સબસીડી સહાય સાથેનો ભાવ
ચણા (જીજી-૫)	સર્ટીફાઇડ	રૂ. ૨૪૫૦/ પ્રતિ બેગ (૨૫ કિલો)	રૂ. ૧૨૨૫/- પ્રતિ બેગ (૨૫ કિલો)
ચણા (જીજી-૩)	સર્ટીફાઇડ	રૂ. ૧૭૦૦/- પ્રતિ બેગ (૨૫ કિલો)	સબસીડી સહાય નથી
ચણા (જીજી-૩, જીજી-૫)	ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર)	રૂ. ૧૬૦૦/- પ્રતિ બેગ (૨૫ કિલો)	
ઘઉં (જીડબલ્યુ-૪૫૧, જીજીડબલ્યુ-૪૬૩)	ફાઉન્ડેશન	રૂ. ૧૬૪૦/- પ્રતિ બેગ (૪૦ કિલો)	રૂ. ૮૪૦/- પ્રતિ બેગ (૪૦ કિલો)
ઘઉં (જીડબલ્યુ-૪૯૬)	સર્ટીફાઇડ	રૂ. ૧૨૪૦/- પ્રતિ બેગ (૪૦ કિલો)	સબસીડી સહાય નથી
ઘઉં (જીડબલ્યુ-૪૯૬, જીડબલ્યુ-૪૫૧, જીડબલ્યુ-૩૬૬, જીજીડબલ્યુ-૪૬૩ અને લોક-૧)	ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર)	રૂ. ૧૧૦૦/- પ્રતિ બેગ (૪૦ કિલો)	

વેચાણનો સમય :- સવારના ૯:૦૦ થી ૧૨:૩૦ તથા બપોરના ૩:૦૦ થી ૬:૦૦

વેચાણનું સ્થળ :- સીડ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ

- નોંધ :-**
૧. ઓનલાઇનન અરજીની નોંધણી થયા બાદ નીકળેલ પાવતીની પ્રિન્ટ કાઢીને તેમાં અરજદારે સહી કરી તેને બિયારણ લેવા આવો ત્યારે જમા કરાવવાની રહેશે તેમજ બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ, જમીનનો ૮-(અ) નો તાજો અસલ દાખલો (છ મહિનાથી જૂનો દાખલો ચાલશે નહીં), બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ (અરજદારનો ખાતા નં. અને બેંકનો IFS Code વંચાય તેવો હોવો જોઈએ) અરજીની પહોંચ સાથે રજૂ કરવાના રહેશે. ઉપરોક્ત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા હોવા જરૂરી છે. જો ફેરફાર હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં.
 ૨. ઘઉં GJW-463 ખરીદ કરવા માંગતા ખેડૂતોએ પણ ડોક્યુમેન્ટના પુરાવા માટે આધારકાર્ડની નકલ, જમીનનો ૮-(અ) નો તાજો અસલ દાખલો (છ મહિનાથી જૂનો દાખલો ચાલશે નહીં), બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ (અરજદારનો ખાતા નં. અને બેંકનો IFS Code વંચાય તેવો હોવો જોઈએ) રજૂ કરવાના રહેશે
 ૩. આ ઉપરાંત ઘઉં GJW-463 ટ્રુથફૂલ બિયારણનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર તથા કૃષિ સંશોધન કેન્દ્ર, અમરેલી એ તા. ૨૦/૧૦/૨૦૨૧ થી વેચાણ ખેડૂતોને વહેલા તે પહેલાંના ધોરણે કરી શકે છે. જો વેચાણ ન થઈ શકે તેમ હોય તો સત્વરે અત્રેના વિભાગને જાણ કરી મોકલી આપવાનું રહેશે.

“ગીર સાવજ” યણા અને ઘઉં (ફાઉન્ડેશન/ સર્ટીફાઈડ/ ટ્રુથકુલ) બિયારણના મેળવવા માટેની શરતો

1. ખેડૂતોએ બિયારણ ખરીદી માટે જુનાગઢ ખાતે લેવા આવવાનું રહેશે
2. જો કોઈ ખેડૂત અરજદારની માહિતી ખોટી/ અપુરતી/ ઘટતી જણાશે તો તેવા અરજદારની અરજી રદ થશે
3. માન્ય અરજીવાળા ખેડૂત અરજદારભાઈઓને બિયારણ કઈ તારીખે લેવા આવવું તેની માહિતી આપના દ્વારા અરજીમાં નોંધવામાં આવેલ મોબાઈલ નંબર પર SMS થી જાણ કરવામાં આવશે. યણાનું વેચાણ અંદાજે તા. ૧૧/૧૦/૨૦૨૧ થી જ્યારે ઘઉંનું વેચાણ તા.૨૦/૧૦/૨૦૨૧ ચાલુ કરવામાં આવનાર છે. એટલે કે યણામાં ઓનલાઈન અરજી કરનાર ખેડૂતોએ યુનિવર્સિટીની વેબસાઈટ તા.૧૦/૧૦/૨૦૨૧ થી જોતા રહેવું. તેવી જ રીતે ઘઉંની ખરીદ કરવા માટે ઓનલાઈન અરજી કરનાર ખેડૂતોએ યુનિવર્સિટીની વેબસાઈટ તા.૧૯/૧૦/૨૦૨૧ થી જોતા રહેવું. તેમાં જે ખેડૂતોને SMS મોકલેલ હશે તેમની યાદી યુનિવર્સિટીની વેબસાઈટ પર જોવા મળશે. ઘઉંની GJW-463 અને GW-366 ની ખરીદી ૨૦/૧૦/૨૦૨૧ વહેલા તે પહેલાંના ધોરણે આવી શકે છે.
4. બિયારણ ખરીદી માટે અરજદારને ફાળવવામાં આવેલ તારીખો એ જ બિયારણ મળશે. એટલે કે અરજદારને જે તારીખો બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવેલ હોય તે તારીખો એ જ લઈ જવાનું રહેશે. ફાળવવામાં આવેલ તારીખો એ જ ખેડૂત બિયારણ ખરીદવા નહિ આવે તો તેનો દાવો રદ ગણવામાં આવશે અને ત્યાર બાદ યાદી મુજબ કમમાં આવતાં અન્ય ખેડૂતને તેનો લાભ મળશે.
5. યણાની GJG-3 અને GG-5 તથા ઘઉંની LOK-1, GW-496 અને GW-451 જાતોના ફાઉન્ડેશન/ સર્ટીફાઈડ/ ટ્રુથકુલ બિયારણની ફાળવણી પૈકી કોઈપણ એક પાકનું એક જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યારે જે જાત અને કક્ષાનો જથ્થો ઉપલબ્ધ હશે તે મુજબ અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પાંચ બેગ સુધી મળવાપાત્ર થશે.(યણા ૧ બેગ=૨૫ કિ.ગ્રા. અને ઘઉં ૧ બેગ=૪૦ કિ.ગ્રા.)
6. હાલમાં દેશમાં ફેલાયેલ COVID-19 ની મહામારીના કારણે જે ખેડૂતમિત્રો તેઓ બિયારણ લેવા માટે ત્યારે જે તે સમયે ગુજરાત સરકારશ્રીની સોસ્યલ ડીસ્ટન્સ, સેનીટાઈઝેશન અને COVID-19 સંદર્ભેની તમામ માર્ગદર્શક સૂચનાઓ અમલમાં હશે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.